

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 મહામારી દરમિયાન બ્લેક હિસ્ટ્રી મહિનો વર્યુઅલી ઉજવશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 1, 2021) – ફેબ્રુઆરી મહિના દરમિયાન, બ્રેમ્પટનના અશ્વેત સમુદાયે શહેર, પ્રોવિન્સ અને દેશને આપેલા અસંખ્ય સાંસ્કૃતિક, આર્થિક અને કરુણામય ડાળાને ઉજવવા સીટી ઓફ બ્રેમ્પટને બ્લેક હિસ્ટ્રી મન્યને ઓળખ આપી છે.

આ સમુદાયના એડવોકેટ્સ, ચેમ્પિયન્સ અને નવીન શોધકર્તાઓ જેવા લોકોને ઓળખ અપાવવા, લોકો મેયર પૅટ્રિક બ્રાઉનના (Patrick Brown) મેકિંગ બ્લેક હિસ્ટ્રી એવોર્ડ્સ માટે રહેવાસીઓનું નામાંકન (નોમિનેશન) કરાવી શકે છે. વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/BHM2021.

COVID-19 ને લીધે, આ વર્ષે પ્રવૃત્તિઓ અને આયોજનો ઓનલાઈન કરવામાં આવશે. આમાં નીચેના કાર્યક્રમો સામેલ છે:

- સન લાઈફ ફાઈનાન્સિયલ સ્થાનિક અશ્વેત કલાકારો દ્વારા એક અઠવાડિક પરફોર્મન્સ સીરીઝ, વર્યુઅલ પરફોર્મન્સ સીરીઝ રજૂ કરશે
- બ્લેક મેકર્સ માર્કેટ જે અશ્વેત લોકોની માલિકીના ધંધાઓ દર્શાવશે
- વેલનેસ અવર જે સ્થાનિક યોગા શિક્ષક મેથ્યુ બોનસ (Matthew Bonas) દ્વારા રજૂ કરવામાં આવશે
- બેસ્ટ એન્ડ બ્લેક ઈન બ્રેમ્પટન ફૂડ ટૂરનું આયોજન એઝેલી હાર્ટ (Azalea Hart) કરશે
- બ્રેમ્પટનનું જોન્સ એન્ડ જોન્સ પ્રોડક્શન્સ પેનલ વિવિધ વિષયો પર ચર્ચા કરશે, જેમ કે મહામારી દરમિયાન રચનાત્મક બની રહેવું, તમારી કારકિર્દી ઘડવી, બ્લેક લાઈવ્સ મેટર અને સ્ટ્રોંગ બ્લેક લિડરશિપ.

બધી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો પર વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/BHM2021.

બ્લેક પોલિટિકલ એમ્પાવરમેન્ટ (અશ્વેત રાજકીય સશક્તિકરણ) કોન્ફરન્સ

ફેબ્રુઆરી 9 અને 10 નાં રોજ આ બ્લેક પોલિટિકલ એમ્પાવરમેન્ટ કોન્ફરન્સ અશ્વેત રાજકીય આગેવાનો અને સાથીઓ સાથે માહિતીપ્રદ અને પ્રેરણાત્મક વાતચીતો કરશે. વાતચીતો આયોજનબદ્ધ જાતિવાદ, સામાજિક, શૈક્ષણિક અને કોર્પોરેટ અસમાનતા દૂર કરવા કાર્યરત થવા માટે અશ્વેત રાજકીય રાજધાની નિર્માણના નિર્ણાયક મહત્વ પર પરંતુ સૌથી મહત્વની બાબત તરીકે, લોકો, કુટુંબો અને યુવાનોને રાજકારણ ક્ષેત્રમાં સહભાગી થવા પ્રેરિત કરવા પર ધ્યાન આપશે. નોંધણી કરાવવા [અહીં](http://www.brampton.ca/blackempowerment) ક્લિક કરો.

બ્લેક યુથ લિડરશિપ (અશ્વેત યુવાન આગેવાની) કોન્ફરન્સ

આપણાં શહેરમાં યુવાનોએ સફળતા મેળવવાની તૈયારી કરવાના હેતુસર નિર્ણાયક પડકારોનો સામનો કરવો પડે છે અને બહુ કામ કરવું પડે છે. આ કાર્યક્રમ, ફેબ્રુઆરી 26 નાં રોજ સવારે 9 થી બપોરે 3:30 વાગ્યા સુધી થશે, જે યુવાનોને પોતાના પડકારો, ચિંતાઓ અને સ્વપ્નોની ચર્ચા કરવા અને જાણાવવા એક મંચ આપવાની તક પૂરી પાડશે. આ કોન્ફરન્સ તેઓના કેટલાક પડકારોના ઉકેલો પર ધ્યાન આપશે અને તેઓની સફળતાને ટેકો આપવાના રસ્તાઓ શોધવામાં મદદરૂપ થવા સંવાદમાં પ્રવૃત્તમય થશે. યુવાનોને બોલવા માટેનું મંચ પૂરું પાડવા ઉપરાંત, કોન્ફરન્સમાં વ્યાવસાયિકો અને પ્રેરક વક્તાઓ પણ સાંભળવા મળશે. આ કોન્ફરન્સ યુવાનો અને સ્કૂલ બોર્ડ્સની પહોંચમાં છે. સહભાગિતા પર વધુ માહિતી મેળવવા કૃપા કરી અહીં ઈમેઈલ મોકલો, economicantiblackracism@brampton.ca.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટનના અશ્વેત સમુદાયે આ દેશને આજની સ્થિતિમાં લાવવા સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર, કરુણામય અને સમૃદ્ધ બનાવવા ઘણું બધું કર્યું છે. અમને બ્લેક હિસ્ટ્રી મન્ય સ્વીકારવા અને ઉજવવા આખા મહિનાના કાર્યક્રમો આપવામાં ગૌરવ થાય છે. મહત્વની ચર્ચાઓ અને

આયોજનબદ્ધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને, અમે આપણાં સમુદાયમાં અશ્વેત સામુદાયિક સભ્યોના મહત્વના ફાળાને ચમકાવવા, વધારે સર્વગ્રાહી શહેરનું નિર્માણ કરવા કાર્યરત છીએ.”

– પેટ્રિક બ્રાઉન (*Patrick Brown*), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણાં સમગ્ર શહેરમાં અશ્વેત આફ્રિકી અને કેરિબીયન સમુદાયોનો બ્રેમ્પટનની સાંસ્કૃતિક રચનામાં અને આપણાં સ્થાનિક અર્થતંત્રમાં બહુ મોટો ફાળો છે. હું બ્રેમ્પટન સીટી કાઉન્સિલમાં ચૂંટાયેલી પહેલી અશ્વેત મહિલા તરીકે, બ્લેક હિસ્ટ્રી મન્થને અર્થસભર રીતે સ્વીકારવાની રીતભાતમાં અગ્રણી બનીને કાઉન્સિલના સાથીઓ અને સભ્યો સાથે જોડાવામાં ગૌરવ અનુભવું છું. સાથે મળીને, આપણે બ્રેમ્પટનના હાલના અને ભૂતકાળના ક્ષયમાં સામુદાયિક સભ્યોએ આપેલા ઘણાં ફાળાને ઓળખ અપાવીએ છીએ, જે સામુદાયિક આગેવાનોની આગામી પેઢી માટેનો માર્ગ મોકળો કરે છે.”

– શાર્માઈન વિલિયમ્સ (*Charmaine Williams*), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન એક રચના (મોઝેઈક) છે, અને બ્લેક હિસ્ટ્રી મન્થને સ્વીકારીને અને ઉજવીને આપણે શહેરની વિવિધતાને ઓળખ આપી રહ્યાં છીએ. અશ્વેત લોકોનો ઈતિહાસ દુનિયાનો ઈતિહાસ છે. તે ઉપલબ્ધિ, નવીન શોધ, સંસ્કૃતિ, અને માનવતાના મૂળમાં શક્તિશાળી અને વિપુલ ઈતિહાસ દર્શાવે છે. આ મહિને, આપણે ક્ષયનો, આપણી સમક્ષ આવેલા લોકોના વારસાને પ્રતિબિંબિત કરવા અને તેમાંથી પ્રેરણા લેવા સમય કાઢી રહ્યાં છીએ – એ આશા રાખીને કે તેનાથી વધારે સમાન, નિષ્પક્ષ, અને સર્વગ્રાહી દેશનું નિર્માણ કરવામાં મદદરૂપ થવા આપણો ભાગ ભજવવામાં એકતા, આદર અને કટિબદ્ધતાની વધારે ચડિયાતી સમજ પૂરી પાડી શકાશે.”

– ગ્વિનેથ ચેપમેન (*Gwyneth Chapman*), સીનિયર એડવાઈઝર, ઈકોનોમિક એમ્પાવરમેન્ટ અને એન્ટી-બ્લેક રેસિઝમ યુનિટ, સીટી ઓફ બ્રેમ્પટન

“આ વર્ષે બ્લેક હિસ્ટ્રી મન્થન આયોજનો બ્રેમ્પટનના અશ્વેત સમુદાયને, અને આપણાં શહેરની સાંસ્કૃતિક રચનામાં સમુદાયના નોંધપાત્ર ફાળાને ગૌરવપૂર્વક ઓળખ અપાવશે અને ઉજવાણી કરશે. આખા મહિના દરમિયાન આયોજનબદ્ધ વર્ચ્યુઅલ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓથી સમગ્ર શહેરમાં વૈવિધ્યસભર સમૂહો સાથે પ્રવૃત્તમય થવા, સાંસ્કૃતિક કાર્યક્રમોને ટેકો આપવા, અને આપણાં ગતિશીલ અશ્વેત સમુદાયને વધુ જાણવાની તક મળે છે. અમે આખા મહિના માટે આયોજનબદ્ધ વિશાળ શ્રેણીના કાર્યક્રમોમાં ભાગ લેવા દરેક વ્યક્તિને આમંત્રિત કરીએ છીએ.”

– ડેવિડ બારિક (*David Barrick*), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

